

HEIL/SE-31/2024-25

August 8, 2024

To, To,

The Manager (Listing), The Manager (Listing),

The BSE Limited National Stock Exchange of India Limited

Phiroze Jeejeebhoy Towers, "Exchange Plaza", C-l, Block - G,
Dalal Street, Bandra - Kurla Complex, Bandra (E)

Mumbai – 400 001 Mumbai – 400 051 Script Code No. : **543600** Symbol : **HARSHA**

Dear Sir/Madam,

Sub: Publication of Newspaper Advertisements - Unaudited Financial Results for the

Quarter Ended June 30, 2024

Ref : Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements)

Regulations, 2015

With reference to the subject matter and pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, we wish to inform you that the Board of Directors of the Company at its meeting held on August 7, 2024 has inter alia approved the Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the Quarter Ended June 30, 2024.

The aforesaid Financial Results were published in the following newspapers on August 8, 2024:

- 1) Business Standard (English)
- 2) Jai Hind (Gujarati)

A copy of the results published is attached herewith. These are also being made available on the website of the company at https://www.harshaengineers.com/InvestorRelations/stockexchange-compliance.php#

You are requested to take the same on your record.

Yours faithfully,

FOR HARSHA ENGINEERS INTERNATIONAL LIMITED

Kiran Mohanty

Company Secretary and Chief Compliance Officer

Mem No.: F9907

Harsha Engineers International Limited

(formerly known as Harsha Engineers International Private Limited and Harsha Abakus Solar Private Limited)

CIN: L29307GJ2010PLC063233

CHANGE OF NAME OLD NAME SHAH JANVI DIGNESH **NEW NAME SHAH JHANVI DIGNESH** S/D SHAH JHANVI DIGNESH ADD: 16, VANDANA SOCIETY, OPF PANINI TANKI, ADAJAN,

SURAT-395009

PUBBICONOTION That, Industrial Purpose land bearing (Admeasuring about 11300 Sq. Mtrs.), Situated at New Survey No. 502/1(Old Survey No. 341 paiki 5), Mouje: Vadagam, Taluka: Dhansura, Dist. & Sub District: Arvalli is owned by Smitaben Kamleshkumar Patel & Hemuben Satishkumar Patel & out of all the properties documents Original Regd. Sale Deed No. 425 on dated 14-08-2014 & its Original Registration Receipt have been lost, misplaced and not available and it is confirmed that it has not placed said original Title Document to any Bank, Financial Institution or any individual etc to create third party lien, charge or hypothecation on the property mentioned above by way of Sale, Agreement, Mortgage, Hypothecation etc. Hence this Notice is published to invite claim, Share, Rights etc of any Bank, Financial Company or any other Individual etc (if any) to raise their claim objection etc in writing along with necessary proof thereof within Fourteen (14) days of publication of this notice & on event of non receipt of any we will issue Title Clearance Certificate which may please be noted & post that, no claim will be earance Certificate which may please be noted & post that, no claim will be

Date: 08-08-2024 Sadik Ghasura, Advocate 215/A. 216. 218 Akash Avenue Cont. No. 079-26405365 Nr. Under Bridge, Mithakhali, Ahmedabad- 380009.



Corporate Office: No. 167-169, 2nd Floor, Anna Salai, Saidapet, Chennai-600015 Branch Office: 3rd, Floor, IFFCO Bhavan, B/h. Maruti Complex, B/h. Pintoo Garment, Nr. Shivranjani Cross Road, Satellite, Ahmedabad-380015.

Saurabhkumar Napit Mo.7874828789, Vikas Savariya Mo. 7984982904, Bunty Ramrakhiyani Mo. 9029004701 Hitesh Kumar Patel Mo.7048336601, Sushil Chaudhary Mo. 8118818160, Nitin Samudre M. 8128310678, Shivam Mishra M. 9033015277 Rajesh Dangar M. 7777900058

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND **ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002**

Notice is hereby given that the following borrower/s who have availed loan from Hinduja Housing Finance Limited (HHFL) have failed to pay Equated monthly installment (EMIs) of their loan to HHFL and that their loan account has been classified as Non-performing Asset as per the guidelines issued by Reserve Bank of India / National Housing Bank. The borrower/s have provided security of the immovable properties to HHFL as on date are also indicated here below. The borrower(s) as well as the public in general are hereby informed that the undersigned being the Authorized Officer of HHFL, the secured creditor has initiated action against the following borrower(s) under the provision of the SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 (the SARFAESI Act). If the following borrower(s) fail to repay the outstanding dues indicated against their names within 60 (Sixty) days of this notice, the undersigned will exercise any one or more of the powers conferred on the Secured Creditor under sub-section (4) of section 13 of the SARFAESI Act, including power to take possession of the properties and sell the same. The public in general is advised not to deal with properties described here below:

N	ame of Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s)	Date & Amount & Loan Account No			
1	BORROWER MR. ASHIFBHAI PATHAN CO-BORROWER MRS. FIROZABANU PATHAN	Dt. 24-05-2024 & Rs. 9,21,681/- & Ac. No. GJ/SRT/KIMH/A00000044			

Demand Notice Date & Amount & Loan Account No Dt 24-05-2024 & Rs. 9,21,681/- & Ac. No.

SCHEDULE OF THE PROPERTY

All parts and parcels of non-agriculture immovable Residential Flat No. 303 on the 3rd Floor admeasuring 546.56 Sq. feet Super Built up area, 353.35 sq. feet ie. 32.83 sq. mts. Built up ares, & 294.46 sq. feet ie. 27.36 Sq. mts. Carpet area, Along with 7.46 sq. mts. undivided share in land of "Shivam Complex of Sandhya Industrial Estate", Situate at Block No. 390 admeasuring Acre 4-16 Guntha, Akar

Rs, 22.37 Paisa Paiki Plot No. 23, 24, 25, 26 & 27 totally admeasuring 594.78 sq. mts, of Moje Village Sayan, Ta: Olpad, Dist: Surat, To be Purchase by (1) Firozabanu Ashifbhai Pathan & (2) Ashifbhal Mayudinbhai Pathan with boundaries as under: East Passage and Flat No 302, West Road, North Flat No 304 and South Road

BORROWER MR. DIPAK MAHAJAN **CO-BORROWER** MRS. SUNANDA MAHAJAN

Dt. 24-05-2024 & Rs. 5,92,574/- & A/c. No. GJ/SRT/KIMH/A000000028

All that piece and parcel of immovable property being Flat No. 304, admeasuring about 842.00 sq. meters super built up area and admeasuring about 505.00 sq. fet i.e. 46.91 sq. meters built up area on the 3rd Floor along with undivided share

admeasuring about 10.13 sq. meters in Vibhag - B in the Scheme known as GOLDEN POINT situated on Plot No. 01 & 51 in FEB WORLD, forming part of land bearing Revenue Survey No. 106, 140/1, Block No. 104, 141, of Mouje Dastan of Palsana Taluka in the Registration District and Sub District of Surat, which is bounded as under; North: Flat No. 303, South: Flat No. 305, East: Passage and West: Road and OTS.

BORROWER MR. LALLU PATHAK CO-BORROWER MRS. NIDHI PATHAK

Dt. 24-05-2024 & Rs. 7,45,949/- & A/C No. GJ/SRT/KIMH/A000000082

All parts and parcels of non-agriculture immovable Residential Flat No. 105 on the 1st floor admeasuring 553.00 sq. feet Super Built up area, & 332.00 sq. feet i.e. 30.86 Sq. mts. Built up area, Along with 8.40 sq. mts. undivided share in the land of "Golden Point, Part-E of

Fab World", Situated at Revenue Survey No. 106, Block No. 104 Total admeasuring He. Are. 1-28-49 sq. mts. i.e. 12849 sg. mts., Akar Rs. 17.19 Paisa, Khata No. 20, & Revenue Survey No. 140/1, Block No. 141 Total admeasuring He. Are. 2-29-66.50. mts. i.e. 22966 50. mts, Khata No. 422 Paiki Plot No. 1 & 51, of Moje Village Dastan, Ta Palsana, Dist: Surat, To be Purchase by (1) Nidhi Pathak & (2) Lallu Pathak with boundaries as under :- East Sarjan Palace Building, West Flat No 104, North Open Space and South Passage

	BORROWER MR. LAXMI NARAYAN SINGH
	CO-BORROWER
4	MRS. PRITI SINGH
	GUARANTOR
	MR. SANTOSH VISHVAKARMA

Dt 24-05-2024 & Rs. 8,50,055/- & A/C No. GJ/SRT/KIMH/A000000110 All parts and parcels of non-agriculture immovable Residential Flat No. 305 on the 3rd Floor admeasuring 433.92 sq. feet i e. 40.31 sq. mts. Built up area, Along with 12.10 Sq. mts. undivided share In the land of "Shivpuja Avenue", Situate at Revenue

Survey No. 124, Block No. 361/A admeasuring He. Are. 1-75-08 sq. mts, Paiki Private Plot No. 361/A/1, 361/A/2, 361/A/3, & 361/A/4, Totally admeasuring 14166 sq. mts., Paiki Unit No. A/7, Plot No. A/2, as Per Private Plot No. 44, & Plot No. A/1, Private Plot No. 45 & Unit No. B/8, Plot No. B/5, As Per Private Plot No. 46 Totally admeasuring 581.52 sq. mts, of Moje Village Jolwa, Ta: Palsana, Dist: Surat, To be Purchase by (1) Laxminarayan Singh Ramchandra Singh & (2) Priti Laxminarayan Singh with boundaries as under: East Flat No 306, West Flat no 304, North Adj Property South Passage And Flat No 302

	BORROWER MR. NIMESH KAMBLE CO-BORROWER MRS. SANGITA KAMBLE
_	MR. NIMESH KAMBLE
Э	CO-BORROWER
	MPS SANGITA KAMBI P

Dt. 24-05-2024 & Rs. 6,95,572/- & A/C No.

All parts and parcels of non-agriculture immovable Residential Flat No. 402 on the 4th floor admeasuring 463.4050. mts. i.e. 43.06 Sq. mts. GJ/SRT/KIMH/A000000107 Super Built Up Area, Along. With Undivided Share in mts. Built Up Area, Along. With Undivided Share in Mts. Built Up Area, Along.

the land of "Shree Nilkanth Palace of Sai Darshan Residency", Situate at Revenue Survey No. 93/1, Block No. 121 admeasuring He. 2-36-63 sq. mts. Paiki Plot No. 232, 233, 234, 235 Totally Admeasuring 270.08 sq. yard i.e. 225.83 sq. mts., of Moje Village Bagumara, Ta: Palsana, Dist: Surat, To be Purchase by (1) Sangita Saniav Kamble & (2) Nimesh Sanjaybhai Kamble with boundaries as under: East Passage and Flat no 406, West Road North Flat No 403 and South 401

	BORROWER MR. RAJKUMAR TIWAR CO-BORROWER MRS. RANDANA TIWAR
	MR. RAJKUMAR TIWAR
ь	CO-BORROWER
	MRS RANDANATIWAR

Dt. 24-05-2024 & Rs. 6,69,269/- & A/C. No. GJ/SRT/HZRA/A000000064 All that right title and interest in Flat No. G- 4 measuring about 570 sq.ft. super built up and 335 sq.ft. ie. 31.13 sq.mt. built up and 285 sq.ft. i.e. 26.49 sq.mt. carpet area situated on the Ground floor of Shivanajali Residency constructed on land bearing Plot no. 128, 129, 130, 131

132, 133 and 134 of Shiv Residency Part-I organized on land Bearing revenue survey no. 364 and 365 and its Block no. 314/K/1/1 of Tatithaiya Sub District Isana District Surat together with undivided oportionate share in the said land belongs to (1) Mrs. Vandna Raikumar And (2) Mr. Raikumar kamlaprasad Tiwari The Said Property is surrounded by: East Passage West Flat no G – 3, North Open Land South Parking.

7	BORROWER MR. RAMESH YADAV CO-BORROWER MRS. SUNEETA YADAV				
'	CO-BORROWER				
	MRS. SUNEETA YADAV				

Dt. 24-05-2024 & Rs. 6.96.763/- & A/C. No. GJ/SRT/HZRA/A000000035

All parts and parcels of non-agriculture immovable Residential Flat No. A/202 on the 2nd admeasuring 576 sq. feet Super Built up area, & 317 sq. feet i.e. 29.46 sq. mts. Built up area, Along with undivided share in the land of Road & C.O.P., in

"Hari Krushna Residency, Building No. A of Bansi Park", Situate at Block No. 91 Paiki Plot No. 13 to 17, of Moie Village Bagumara, Ta: Palsana, Dist: Surat, To be Purchase by (1) Suneeta Ramesh Yadav & (2) Ramesh Narayan with boundaries as under:East Passage and Flat No 207, West Building B,North Flat No 203 and South Building No B.

CO-BORROWER MR. RUDRAPRASAD 8 BHUYAN BORROWER MRS. SAGARI BHUYAN

Dt. 24-05-2024 & Rs. 7,96,754/- & A/C No. GJ/SRT/HZRA/A000000037

All parts and parcels of non-agriculture immovable Residential Flat No. 103 on the 1st Floor admeasuring 325 sg. feet i e 30.20, mts. Built up area. & 591.5. feet i e. 54.92 sq. mts. Super Built up area, Along with 7.11 sq. mts undivided share in the land

of Parking In "Marutinandan Residency, Building No. B of Bansi Park, Situated at Block no. 91 Paik Plot No. 89 to 92, of Moje Vilage Bagumara, Ta: Plsana, Dist. Surat. To be purchase by (1 Sagar Rudra Bhuyan & (2) Rudraprasad Rabindranath Bhuyan with boundaries as under :East Krishna Residency, West Adj Flat No 102, North Adj Building A South Adj Flat No 104.

MRS. LALMUNIDEVI

Dt. 24-05-2024 & Rs. 9,55,217/- & A/C No. GJ/SRT/OLPD/A000000019

All that piece and parcel of immovable property being Flat No.105, admeasuring about 995.00 sq. feet i.e. 92.47 sq. meters super built up area and 600.00 sq. feet i.e. 55.76 sq. meters built up area on 1st floor along with undivided share in the Scheme known as PLATINUM PLAZA situated on Plot No. 29 to 32 in BANSI PARK, forming part of revenue Survey No.73, Block No.91 of Mouie Bagumara of Palsana Taluka in the Registration District and Sub District of Surat. which is bounded as under; North: Adjoining Road, South: Adjoining Plot No.28. East: Adjoining Plot No 3 to 6 And

West: Adjoining Road BORROWER Dt. 24-05-2024 &

MR. VINAY KANT SINGH 10 CO-BORROWER MRS. ANITA DEVI

HARIJAN

Rs. 8.81,254/- & A/C No. GJ/SRT/KDRA/A000000039

All parts and parcels of non-agriculture immovable Residential Flat No. A/403 on the 4th Floor admeasuring 525 sq.feet i.e. 48.83 sq, mts. Super Built up area, & 289.00 Sq. feet i.e. 26.86 sq. mts. Built up area. & 263 Sq. feet ie. 24.44 sq. mts. Carpet area, Along with undivided share in the Land

of "Shantinath Palace, Building No. A of Shivam Residency", Situate at Revenue Survey No. 102/1, 102/2, Block No. 104 & 105 Paiki Plot No. 107, 108,109, of Moje Village Kadodara, Ta: Palsana, Dist: Surat, To be Purchase by (1) Anita Devi Vinay Kant Singh & (2)Vinay Kant Singh with boundaries as under :- East Building No B Open Plot, West Passage Flat No 402, North Flat No 404 and South Open Plot

If the said borrowers shall fail to make payments to HHFL as aforesaid, HHFL shall proceed against the above secured assets under section 13(4) of the Act and the Applicable Rules, entirely at the risks of the said Borrowers as to the costs and consequences. The said borrowers are prohibited under section 13(13) the act from transferring the aforesaid assets, whether by way of sale, lease or otherwise without the prior written consent of HHFL. Any person who contravenes or abets contravention of the provision of the said Act or Rules made there under, shall be liable as per the provision of section 29 with imprisonment and/or penalty as provided under the Act.

Place: SURAT Date: 08-08-2024

Authorized Officer For, Hinduja Housing Finance Limited

Place: Raikot

HARSHA

ENGINEERS

HARSHA ENGINEERS INTERNATIONAL LIMITED

CIN:L29307GJ2010PLC063233

Regd. Office: Sarkhej-Bavla Road, Changodar, Ahmedabad, Sanand-382213, Gujarat, India. Ph: +91 2717 618200, Fax: +91 2717 618259 Web: www.harshaengineers.com Email: sec@harshaengineers.com

STATEMENT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2024 (₹ in Lakhs)

			Consolidated				
			Year Ended				
Sr. No.	Particulars	30-06-2024	31-03-2024	30-06-2023	31-03-2024		
		Unaudited	Audited	Unudited	Audited		
			Refer Note 4				
1	Total Income from Operations	34,316	38,040	34,796	139,230		
2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	5,030	4,948	3,364	15,075		
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional Items)	5,030	4,948	3,364	15,075		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	3,605	3,678	2,458	11,143		
5	Total Comprehensive Income for the period [comprising profit / (Loss)	3,645	3,826	2,805	11,543		
	for the period (after tax) and other Comprehensive Income (after tax)]						
6	Equity Share Capital (Paid-up)	9,104	9,104	9,104	9,104		
7	Other Equity (Excluding Revaluation Reserve) as per the Audited Balance Sheet of previous year	-	-	-	108,424		
8	Earnings Per Share (of ₹ 10 each) (not annualised) (for discontinued and continued operations)						
	(a) Basic	3.96	4.04	2.70	12.24		
	(b) Diluted	3.96	4.04	2.70	12.24		

1. Additional Information of Unaudited Standalone Financial Results is as under

/₹ in Lakhe)

· · · · · · · · · · · · · · · · · · ·		Additional midment of ordeditor of analysis in manifest meaning to do distance.				
Si			ndalone			
	Quarter Ended			Year Ended		
Particulars	30-06-2024	31-03-2024	30-06-2023	31-03-2024		
Uı	Unaudited	Audited	Unudited	Audited		
		Refer Note 4				
Revenue from Operations	25,830	29,753	25,616	108,094		
Profit / (Loss) before Tax	5,175	5,008	3,889	16,765		
Profit / (Loss) After Tax	3,856	3,759	2,976	12,691		
Total Comprehensive Income (after tax)	3,896	3,907	3,323	13,091		
	Revenue from Operations Profit / (Loss) before Tax Profit / (Loss) After Tax	Particulars 30-06-2024 Unaudited Revenue from Operations 25,830 5,175 Profit / (Loss) After Tax Profit / (Loss) After Tax 3,856	Particulars 30-06-2024 31-03-2024 Unaudited Refer Note 4	Revenue from Operations 25,830 29,753 25,616 Profit / (Loss) After Tax 3,856 3,759 2,976		

- 2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites viz www.bseindia.com and www.nseindia.com. The same are also available on the Company's website viz. www.harshaengineers.com.
- 3. The above Unaudited Financial Results for the quarter ended 30 June, 2024 have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors in their respective meetings held on 7 August, 2024.
- 4. Figures of the quarter ended 31 March, 2024 is the balancing figures between audited figures in respect of the full financial year and year to date figures up to the third quarter of the relevant financial year. Also the figures up to the end of third quarter had only been reviewed and not subject to audit.

By order of Board of Directors

For, HARSHA ENGINEERS INTERNATIONAL LIMITED

Sd/ Rajendra Shah

Chairman & Whole Time Director

DIN: 00061922



Place: Ahmedabad

Date : 7 August, 2024

Asset Recovery Branch: Union Bank Bhavan, 4th Floor, Racecourse Road, Opp. Indoor Stadium, Rajkot. E Mail: arb.rajkot@unionbankofindia.bank

MEGA E - AUCTION SALE NOTICE (For sale of Immovable/Movable Properties)

E Auction Sale Notice for Sale of Movable/Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 read with provision to Rule 6(2) or 8(6) of Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and Guarantor/s, that the below described movable/immovable property mortgaged / charged to Union Bank Of India (secured creditor), possession of which has been taken by the Authorized Officers of Union Bank of India, will be sold on "AS IS WHERE IS", "AS IS WHAT IS", and "WHATEVER THERE IS" basis, for recovery of respective dues mentioned hereunder against the secured assets mortgaged/charged to Union Bank of India, from respective borrower(s) and guarantor(s). The reserve price and earnest money deposit is shown there against each

Sr. No.	Name of the Borrower/Guarantor	Description of the properties	Total dues	Possession	Reserve Price/ EMD/ Bid increase amount in Rs
01	Borrowers: M/s. Laxmi Silver Works, Mr. Kuman Ramubhai Rajabhai (Borrower), Mr. Shrinivasbhai Rajabhai Kuman (Guarantor) & Lt. Kuman Ramubhai Rajabhai	Residential Flat No.103 1st Floor, Om Heights, 5 Ranchhodnagar Society, Near Rajput Wadi, Off Kuvadva Road, Rajkot R. S. No. 123/P, Plot No. 182/P, T.P.S. No. 8, O.P. No. 10, F.P. No. 46, City Survey Ward No. 12/1,Owned by Mr. Ramubhai Rajabhai Kumaan, Area : 42.31 Sq. Mtr (Property description as specified in the Registered Sale Deed No. 5620 dated 12/08/2013) North: Open Margin Space, South: Flat No.102, East: Lift passage & Flat No.101, West: Other Property	Rs. 92,20,412.65 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 22,70,000 EMD 10% Bid Increase 1%
02	Borrower: M/s. VRG Energy India Pvt. Ltd., Directors: Mr. Vijay Janubhai Rathod, Mr. Ritesh Babubhai Kamani, Mr. Ghanshyam Vallabhbhai Kapuriya, Guarantors: Mr. Babubhai Popatbhai Kamani, Mr. Janubhai Bhayabhai Rathod, Mr. Vallabhbhai Nathabhai Kapuriya, Mr. Vijay Janubhai Rathod, Mr. Ritesh Babubhai Kamani, Mr. Ghanshyam Vallabhbhai Kapuriya	All That Piece and Parcel of Commercial Shop Situated at City Survey No. 2851/1/1/l Paiki, City Survey Ward No. 6/2, T.P.S. No. 03, F.P. No. 74, "Municipal Shopping Center", 1st Floor, Shop No. 128, Chandreshnagar Main Road, Rajkot, Admeasuring Carpet Area 22.22 Sq. Mtr. Owned by Mr. Babubhai Popatbhai Kamani. Bounded By: North: Shop No. 127, South: Shop No. 129, East: Shop No. 126, West: Entry, Passage, Parking and Chandreshnagar Main Road.	Rs. 4,28,81,063.17 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 26,60,000 EMD 10% Bid Increase 1%
03	Guarantors), Mrs. Dharmishtha J. Dave	All That Piece and Parcel of Residential Flat No. H 404 admeasuring 55.47 Sq. Mts., Build Up Area on 4th Floor of unit A of Building H of Backbone Residency, Constructed on lands of Plot No. 7 to 12, 25 to 30 of R. S. No. 27 Paiki of Village Madhapar, Tal. & District: Rajkot in the name of Mrs. Dharmishtha J. Dave. (Property description as specified in the sale Deed No. RKT-3-RNP 5260 dated 16-05-2012.) Bounded: On the North by: Building G, On the South by: Flat No. H 403, On the East by: Lift Stair Than Flat No. H 401, On the West by: Margin Space then Road	Rs. 48,01,896.50 with further interest at contractual rate & cost thereof	Symbolic	Rs. 14,60,000 EMD 10% Bid Increase 1%
04	Bharatkumar Chikani, Guarantor : (1) Mrs.	An Industrial Plot No. 219, admeasuring 732.12 Sq. Mt., situated in Talod Industrial Estate of Revenue Survey No. 518 Paiki of Village: Talod of Talod Taluka of Sabarkantha District, along with construction of industrial shed/building made thereon, leased to Varshaben Bharatbhai Chikani. Boundaries are as follows: North: Plot No. 205 & 206+207, South: 14-00 Mt. Wide Road, East: Plot No. 220 & 205, West: Plot No. 218	Rs. 70,65,537.55 with further interest at contractual rate & cost thereof	Symbolic	Rs. 22,00,000 EMD 10% Bid Increase 1%
05	Borrower : M/s. Jadeja Industries Pvt Ltd (firm) Guarantors : 1. Mr. Keshrisinh Indrasinh	Property No. 1: P & M for Manufacturing Particle Boards & Allied Items situated at Survey No. 20/1 paiki & 20/3, Near Snob Sanitaryware, Bhojapar Road, At Village: Bhojapara, Tal.: Wankaner, Dist.: Morbi.	Rs. 13,02,16,598.26 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 1,80,00,000 EMD 10% Bid Increase 1%
06	Indain 2 Mr. Hitandrasinh Mahandrasinh	Property No. 2: (a) P & M for Manufacturing Particle Boards & Allied Items situated at Survey No. 20/1 paiki & 20/3, Near Snob Sanitaryware, Bhojpara Road, At Village: Bhojpara, Tal.: Wankaner, Dist.: Morbi, (b) Industrial Land, Factory Shed with Allied Civil Construction situated at Survey No. 20/1 paiki & 20/3, Near Snob Sanitaryware, Bhojpara Road, At Village: Bhojpara, Tal.: Wankaner, Dist.: Morbi, Extent of the site (least of 14A & 14B): 6000.00 Sq. Mtrs. Boundaries of the Property: Sur. No. 20/1: North: Sur. No. 20/1, Remaining Land, South: Sur. No. 20/3, East: Waste Land, West: Waste Land, Sur. No. 20/3: North: Sur. No. 20/1, Waste Land, Sur. No. 20/2, Waste Land, East: Waste Land, West: Waste Land, West: Waste Land		Physical	Rs. 3,80,00,000 EMD 10% Bid Increase 1%
07		Residential 2 BKH Flat, Rajpath Wing B, Part-D, 7th Floor, Flat No. 703, Kangasiyali, R.S. No. 67/1p, Plot No. 93 to 96, B/h Khodiyar Hotel, Off Rajkot Gondal National Highway, At: Kangasiyali (Rajkot) 360 022, Tal.: Lodhika, Dist.: Rajkot, owner Shri Chenaram Shankarram Chaudhary, Built-up area 596.32 Sq.ft. (Property description as specified in the Registered Sale Deed No. 1241 dated 25/04/2016) Bounded: On the North by: Open to Sky & Margin, On the South by: O.T.S. & Flat No. D-704, On the East by: Open to Sky & Wing – C Building, On the West by: Passage & Flat No. D-702	Rs. 39,42,458.58 with further interest at contractual rate & cost thereof	Physical	Rs. 11,80,000 EMD 10% Bid Increase 1%
08	Borrower: M/s. Vision Bio Products India Pvt. Ltd. 1. Mr Jigneshbhai Shivlalbhai Sipariya 2. Mr. Jigarbhai Dilipbhai Akabari 3. Mr. Parimalbhai Gadhesariya 4. Mr. Sureshbhai Shivabhai Sipariya 5. Mr. Ghanshyam Shivshankar Mehta	Residential House No. A-11/2 over the Land admeasuring 61.67 Sq. Mtrs. (73.76 Sq. Yards) of Sub Plot No. 13 to 15+ 18 to 20/5 to 20/4 paiki, Northern side land of the area known as "Maruti Park" (Old Yogi Park) of Village: Metoda, R. S. No. 46, 47/1 & 48/2 paiki of Taluka: Lodhika, Dist.: Rajkot. Owned by Mr. Sureshbhai Shipariya and Mr. Shivabhai Bachubhai Sipariya. (Property description as mentioned in Sale Deed No. 3167 dated 29.06.2012) Boundaries: North: Property on Plot No. 16+17, South: Sub Plot No. 13 to 15+18 to 20/4 Paiki Block No. A-11/1, East: Property on Plot No. 13 to 15+18 to 20/5, West: 7.50 Mts. Road	Rs. 2,67,69,597.11 with further interest at contractual rate & cost thereof	Symbolic	Rs. 12,07,000 EMD 10% Bid Increase 1%
09	6. Mr. Shivlal Bachubhai Sipariya	Residential House No. A-1 over the Land admeasuring 61.58 Sq. Mtrs. (73.65 Sq. Yards) of Sub Plot No. 9 to 12 and 21 to 24/2+3 paiki, Southern side land of the area known as "Maruti Park" (Old Yogi Park) of Village: Metoda, R. S. No. 46, 47/1 & 48/2 paiki of Taluka: Lodhika, Dist.: Rajkot. Owned by Mr. Jigneshbhai Shivabhai Sipariya and Mr. Shivabhai Bachubhai Sipariya. (Property description as mentioned in Sale Deed No. 3491 dated 18.07.2012) Boundaries: North: Sub Plot No. 9 to 12 & 21 to 24/2 + 3 Paiki Block No. A/2, South: Sub Plot No. 9 to 12 & 21 to 24/1 Paiki Property, East: Sub Plot No. 9 to 12 & 21 to 24/1 Paiki Property, West: 7.50 Mts. Road		Symbolic	Rs. 11,90,000 EMD 10% Bid Increase 1%
10		Commercial Property admeasuring 33.26 Sq. Mtrs., addressed as Office No. 232 (16.63 Sq. Mtrs.) and Office No. 233 (16.63 Sq. Mtrs.) located on 2nd Floor of the building known as "Vision Elevators Pvt. Ltd." of Backbone Shopping Centre, Nr. Mayani Chowk, Chandreshnagar Main Road, constructed over the land admeasuring 4043.00 Sq. yards of F. P. No. 74 of T. P. Scheme No. 3, City Survey No. 2851 paiki of Ward No. 6 of Rajkot owned by Mr Jigneshbhai Shivabhai Sipariya. (Property description as mentioned in Sale Deed No. 8655 dated 07.11.2012) Boundaries: North: Office No. 225, South: Passage then Marginal Space or Building Entry, East: Office No. 234, West: Office No. 231		Symbolic	Rs. 23,04,000 EMD 10% Bid Increase 1%
11		Residential House known as "Sangeet", over the land admeasuring about 68.975 Sq. Mtrs. (82.50 Sq. Yards) of Plot No. 29P of N A land of R.S. No. 469/2 and 470P, City Survey Ward No. 16, C.S. No. 943, addressed as Plot No. 29P, Rajkot, owned by Mr. Ghanshyambhai Shivshankarbhai Mehta. (Property description as mentioned in Sale Deed No. 7498 dated 11.07.2008) Boundaries: North: Other's Property on Plot No. 29P, South: 50 Ft. Road, East: Other's Property on 29P, West: Other's Property		Symbolic	Rs. 60,60,000 EMD 10% Bid Increase 1%

Date and time of Auction: 29.08.2024 from 12.00 NOON to 5.00 PM (UNLIMITED EXTENSION OF 10 MINUTES) Property Inspection (BY TAKING PRIOR APPOINTMENT) Inspection Date: 20.08.2024, Time: 11.00 AM to 4.00 PM

Property

 For detailed Terms and Conditions of Sale, Please refer to the link provided in https://www.unionbankofindia.co.in/auction-property/view-auction-property.aspx & https://ebkray.in Perspective bidders may contact for more details to Mr. Parveen Verma - Mob : 70158 94944, Mr. M. R. Jadeia - Mob : 98252 89952 and Mr. Jaddish Kumar - Mob : 73895 89964 (GST/TDS shall be payable as per applicable Government Rules by purchaser on sale of Moyable/Immoyable Assets)

AS PER SARFAESI Act, STATUTORY 15 - DAYS SALE NOTICE TO THE BORROWER/ GUARANATOR/ MORTGAGOR

The above mentioned Borrower's is/ are hereby noticed to pay the sum as mentioned in section 13 (2) Notice in full before the date of auction, failing which property will be auctioned/ sold and balance dues if any will be recovered with interest and cost from Borrower's/ Guarantor's/ Mortgagor. Date: 05.08.2024.

Terms & Conditions

Scan here

For detailed

(In The Event Of Any Discrepancy Between The English Version And Any Other Language Version Of This Auction Notice, The English Version Shall Prevail)

Authorised Officer Union Bank of India

ગુજરાતની કંપનીઓએ શેરબજારમાં એક જ દિવસમાં ૮૩,૦૦૦ કરોડ ગુમાવ્યા

બજારની ઉથલપાથલને કારણે સોમવારે શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જેના કારણે નોંધપાત્ર અસર થઈ હતી. રાજ્યની અગ્રણી કંપનીઓએ એક જ દિવસમાં ૮૩,૦૦૦ કરોડથી વધુની ખોટ ખાધી હતી. એનએસઈ નિફ્ટીમાં ર.૬૮ ટકાના ઘટાડા સાથે ૨૪૦૫૫ પર બંધ થઈ હતી, જ્યારે બીએસઈ સેન્સેક્સ ૨.૭૪ ટકા ઘટીને ૭૮૭૫૯ પર બંધ થયું હતું. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ, અદાણી પાવર અને ટોરેન્ટ પાવર લિમિટેડ જેવી કંપનીઓના શેરમાં ૫ ટકાનો ઘટાડો થયો હતો. વરિષ્ઠ સંશોધન વિશ્લેષક તૂટે તો આપણે વધુ નુકસાન થશે. હિતેશ સોમાનીએ જણાવ્યું હતું કે, ''મોટાભાગની કંપનીઓ ૩ ટકાથી ગુંજન ચોક્સીએ જણાવ્યું હતું કે , છે, અને ગુજરાત આધારિત વધુ ઘટી હતી, અને પાંચ અગ્રણી કંપનીઓમાં ૫ ટકાથી વધુનો ઘટાડો વેચાણ-બંધને કારણે છે ,જેમાં યેન જે મંદી ઘટાડવામાં મદદ કરશે.

પડશે. ડેલ લગભગ ૧૦ ટકા

કર્મચારીઓને નોકરીમાંથી કાઢી

મૂકશે. જેના કારણે તેના

કર્મચારીઓની સંખ્યામાં

લગભગ ૧૨,૫૦૦નો ઘટાડો

થશે. આ છટણીની સૌથી વધુ

અસર તેના વેચાણ વિભાગ પર

પડશે. દાવો કરવામાં આવી રહ્યો

છે કે આ નિર્ણયની ખરાબ અસર

અધિકારીઓ પર પણ પડી છે.

અમદાવાદ.તા.૭ : વૈશ્વિક થયો હતો. છેદ્ધા બે ટ્રેડિંગ દિવસોમાં કેરીનો વેપાર મુખ્ય પરિબળ છે , જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને ઈઝરાયલ - ઈરાન યુદ્ધના કારણે બજારો ડાઉન છે

૧૨૦૦૦થી વધુ કર્મચારીની જશે નોકરી

'ડેલ'માં મોટી છટણીની જાહેરાત

ટેક ઇન્ડસ્ટ્રીમાં છટણીનું આધારિત વેચાણ એકમ પણ અમારા બિઝનેસને નવી દિશા

પ્રમાણ વધતું જાય છે. ઇન્ટેલ બનાવવામાં આવશે. કંપની આપવા વિશે ગંભીરતાથી

(Intel) બાદ હવે વિશ્વની એઆઈ પરફોકસ વધારવા માંગે વિચાર કરી રહ્યા છીએ.

જાણીતી કમ્પ્યુટર નિર્માતા કંપની છે. જો કે, કંપનીએ છટણીની મેનેજમેન્ટને રીસ્ટ્રક્ચર કરવા

ડેલે છટણી અંગે

સ્ટાફને સૂચના આપી

દીધી છે : આ

છટણીનો સૌથી વધુ

માર સેલ્સ ટીમ પર

પડવાનો છે

વેચાણ ટીમ પર પડશે માર, મોડર્નાઇઝેશન સ્ક્રીમ પર કામ પ્રેસિડેન્ટ જેવા મોટા પદ પર

આંતરિક મેમો દ્વારા જાણ કરી જહોન બાયર્ન દ્વારા મોકલવામાં માર્કેટિંગ અને ઓપરેશન્સ ટીમ

દીધી છે. કંપનીએ જણાવ્યું છે કે આવ્યો છે. તેને ગ્લોબલ સેલ્સ પણ છટણીની શિકાર થઈ છે.

તે તેની વેચાણ ટીમમાં ફેરફાર મોડર્નાઇઝેશન અપડેટનું નામ હવે એક મેનેજર પાસે ઓછામાં

કરવા જઈ રહી છે. આ ઉપરાંત આપવામાં આવ્યું છે. તેમાં ઓછા ૧૫ લોકોની ટીમ છે.

શિકાર બનશે. ગ્લોબલ સેલ્સ મેનેજર, ડાયરેક્ટર અને વાઇસ

નવી દિલ્હી. તા.૭ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવ્યં છે કે અમે

ભારતીય શેરબજારોમાં તીવ્ર ઘટાડો તેની સાથે નબળા યુએસ અને જાપાનની સ્થિતિ તેમજ ઈરાન ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષ ઇઝરાયેલ વચ્ચે ભૌગોલિક રાજકીય ગુજરાત સ્થિત કોર્પોરેટ્સને વેચાણના અને યુ.એસ અને જાપાનીઝ તણાવના કારણે વૈશ્વિક રોકાણકારો તેમનામાં ઘટાડો કરી રહ્યા છે. જો કે, ગુજરાત સ્થિત કોર્પોરેટ્સ મજબૂત નાણાકીય અને ફંડામેન્ટલ્સ ધરાવે છે, તેથી લાંબા ગાળાનો દષ્ટિકોણ સકારાત્મક છે.

> સ્ટોક બ્રોકિંગ ફર્મના એમડી તન્મય શાહે સલાહ આપી હતી કે , " આજે બજારનો ઘટાડો મુખ્યત્વે વૈશ્વિક મેક્કો-ઇકોનોમિક બજારોમાં નોંધપાત્ર ઘટાડા જેવા પરિબળો અને ભૌગોલિક-રાજકીય પરિબળોએ ગુજરાત સ્થિત તણાવને કારણે છે. લાંબા ગાળાના કંપનીઓને અસર કરી હતી. જો રોકાણકારોએ કોર્સમાં રહેવું જોઈએ િનફ્ટી ૨૪૦૦૦ ના સ્તરની નીચે અને ઘટાડાનો લાભ મેળવવા માટે વ્યવસ્થિત રોકાણો પર વિચાર કરવો સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેક્ટર જોઈએ. ભારતીય અર્થતંત્ર મજબૂત " ભારતીય શેરોમાં કરેક્શન વૈશ્વિક કંપનીઓની કમાણી મજબૂત છે,

૧૦ રાજ્યોમાં ભારે વરસાદના એલર્ટ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાનમાં પૂરની ચિંતાજનક સ્થિતિ સર્જાયેલી છે. રાજસ્થાનના પાલીમા ઘરોમાં પાંચ ફુટ પાણી ભરાયા છે. ગેંગા નદીના ઉપરવાસના વિસ્તારમાં મુશળધાર વરસાદ પડતા ગંગા નદીમાં આવેલા ઘોડાપુરના પાણી પ્રયાગરાજમાં કિનારા વિર નજીકના વિસ્તારોમાં ફરી વળેલા નજરે પડે છે.

પિતાએ દલીલ કરી કે, તેની પાસે પૂરતી આવક નથી

પિતા હોવાને કારણે અરજદારને આ જવાબદારીમાંથી મુક્ત મળતી નથી: HC

હાઈકોર્ટે તાજેતરમાં જ એક અરજી પર સુનાવણી હાથ ધરી બાળકોના પિતા હોવાને કારણે હતી. આ સુનાવણી દરમિયાન તેમનું ભરણ-પોષણ કરવું એ કોર્ટે કહ્યું હતું કે, "બાળકોની પિતાની કાયદાકીય અને નૈતિક સાર-સંભાળ રાખવાની જવાબદારી છે. એ વાત સાચી જવાબદારી પિતાની છે. માતા છે કે બાળકોની માતા કામ કરતી

કામ કરતી હોય છટણીની અસર સમગ્ર વિશ્વ પર દાવો કરવામાં આવ્યો છે કે ૧૦ આપણા વેચાણ વિશે ફરીથી નાના બાળકોની ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ રાખવાની જેવા મોટા પદ પર બેઠેલા લોકો જવા બદા રી પર ગિરી ગાજ ડેલના વેચાણ પિતાની છે."

જસ્ટિસ સંજય "માતા ભલે કામ કરતી હોય, પરંતુ પિતા પોતાના બાળકોના પણ છટણીના શિકારથયા છે. ભરણ પાેષ્ાણ ની કંપનીના ઘણા મોટા ટકાથી વધુ કર્મચારીઓ તેના આ છટણીની સૌથી વધુ અસર જવાબદારીમાંથી મુક્ત થઈ

કોર્ટમાં એક વ્યક્તિએ દલીલ એઆઈ પર આપવામાં આવશે કરી રહી છે ડેલ રિપોર્ટમાં દાવો બે ઠેલા લોકો પર પડી છે. કરી હતી કે. "તેની પાસે તેના ધ્યાન બિઝનેસ ઇન્સાઇડરના કરવામાં આવ્યો છે કે આ આમાંથી કેટલાકતો ૨૦ વર્ષથી સગીર બાળકોના ભારણ-રિપોર્ટ અનુસાર, ડેલે છટણીની આંતરિક મેમો ડેલના સિનિયર પણ વધુ સમયથી કંપની સાથે પોષણ માટે પૂરતી આવક આ યોજના વિશે કર્મચારીઓને એક્ઝિક્ચુટિવ બિલ સ્કેનલ અને જોડાયેલા હતા. આ ઉપરાંત નથી."

તે વ્યક્તિએ એવી પણ દલીલ કરી હતી કે, "તેની અલગ પડી ગયેલી પત્ની (અને દલીલ કરી હતી કે, તેની માસિક તેના બાળકોની માતા) કામ આવક માત્ર ૧૨,૦૦૦ રૂપિયા બાળકોની સંભાળ રાખવા માટે બાળકોના ભરણપોષણ તરીકે

HARSHA

જમ્મ-કાશ્મીર અને લદ્યાખ દલીલ ફગાવી દીધી હતી.

કોર્ટે કહ્યું કે, "નાના

ડેલ (Dell)એ પણ મોટા પાયે ચોક્કસ સંખ્યા વિશે માહિતી અને રોકાણની પ્રાથમિકતાઓ અને કમાતી હોય **માતા કમાતી હોય તો** છટણીની જાહેરાત કરી છે. આ આપી નથી. પરંતુ, રિપોર્ટમાં પણ બદલાઈ રહી છે. આપણે તો પણ તેના **પણ બાળકોના ઉછેર** આવકનો સ્ત્રોત વિચારવાની જરૂર છે. મેનેજર, સંભાળ માટે પૈસા આપવા એ તેનાથી પિતા હોવાને કારણે પિતાની જવાબદારી: અરજદારને હાઇકોર્ટની ટિપ્પણી તેમ્ના

બાળકો ના દાવો છે કે તેમને નોકરીમાંથી ધરે સુનાવણી દરમિયાન કહ્યું કે, ભાર ણાયાે ષાણાની જવાબદારીમાંથી મુક્ત મળતી નથી તેથી આ દલીલ પાયાવિહોણી છે." અરજદાર વ્યક્તિએ તેના ત્રણ બાળકો માટે ભરણપોષણ તરીકે ૪,૫૦૦ રૂપિયા ચૂકવવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકાર્યો હતો. સેશન્સ કોર્ટ દ્વારા ભરણપોષણ ચૂકવવાના આદેશને પડકારવામાં આવ્યા બાદ આ વ્યક્તિએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.આ વ્યક્તિએ હાઈકોર્ટમાં કરતી સ્ત્રી છે જેની પાસે છે અને તેના માટે તેના વિદેશમાં

શકાય. જો કે, તેણે ટ્રાયલ કોર્ટ સમક્ષ એવો કોઈ પુરાવો રજૂ કર્યો ન હતો કે તે દર્શાવે કે વ્યક્તિ દર મહિને માત્ર 92,000 રૂ પિયા કમાય છે. બીજી તરફ, કોર્ટે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે વ્યક્તિ એક

શક્ય નથી. તેણે કહ્યું કે, તેણે તેના બીમાર માતા-પિતાને પણ સપોર્ટ કરવો પડશે. તેણે વધુમાં દલીલ કરી હતી કે, બાળકોની માતા સરકારી શિક્ષિકા હતી જેને સારો પગાર મળતો હતો. આવી સ્થિતિમાં બાળકોના ભરણપોષણની જવાબદારી

તેના એકલા પર ન મૂકી

લાય ક એન્જિનિયર અગાઉ

કામ કર્યું હતું.

સંઘરેલા શેર પણ કામ લાગે છે!! દાદાએ ૨૦૦૪માં લીધેલા ૫૦૦ શેર

પૌત્રીને પોણા બે કરોડ અપાવ્યા!!

આનું નામ નસીબ. આ લોટરી બેંગ્લોરની પ્રિયા શર્માને લાગી છે. ૨૦૨૦માં કોરોનાને કારણે લોકડાઉન હતો. ઘરની બહાર નીકળવાનું નહોતું એટલે પ્રિયા શર્માએ ટાઈમપાસ કરવા માટે દાદાનું વસિયતનામું વાંચવાનું નકકી કર્યું. વિલ લેવા ગઈ ત્યાં ખાનામાં કેટલાક જૂના શેર પર નજર ગઈ. પ્રિયાના દાદાએ છેક ૨૦૦૪માં એલ એન્ડ ટી કંપનીના શેર લઈ રાખ્યા હતા

અને પછી સંજોગોવશાત રોકાણ નહીં કર્યું હોય. બ્લુચીપ કંપનીના શેર હતા એટલે સ્વાભાવિક રીતે જ સ્ટોકનું મૂલ્ય તો વધવાનું જ હતું. વારસામાં મળેલા આ ૫૦૦ શેર પર પ્રિયા શર્માને બોનસ શેર અને સ્ટોક વિભાજન સાથે ૪૫૦૦ સ્ટોક મળ્યા. ઓટલે કે શેર ૯ ગણા વધી ગયા. એ જ રીતે શેરમૂલ્ય પણ વધી ગયું. અત્યારે આ સ્ટોકની કિંમત નહીં-નહીં તોય ૧.૭૨ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

નેશનલ ઈન્સ્ચુરન્સ વીમોસેવા સહકારી મંડળી લી. 'ચંદાનિવાસ', કર્ણાવતી હોસ્પિટલ સામે, ટાઉન હોલ પાસે, એલીસબ્રીજ, અમદાવાદ–૬. વાર્ષિક સાદારણ સભાની નોટીસ

આથી, તમામ સભ્ય, સહકારી મંડળીઓ, ટ્રસ્ટ, સંગઠનો (ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, બિહાર) તથા સર્વે વ્યક્તિગત સભ્યોને (૫ રાજ્યોમાં) જણાવવાનું કે, નેશનલ ઈન્સ્ચોરન્સ વીમોસેવા સહકારી મંડળી લી. અમદાવાદની વર્ષ ૨૦૨૪ ની વાર્ષિક સાધારણ સભા તા. ૨૯.૦૮.૨૦૨૪, ગુરૂવાર, સમય :

સવારે ૧૧:00 વાગે રાખવામાં આવેલ છે. તેમાં આપ સર્વે ને આમંત્રણ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી તારીખ : ૦૮.૦૮.૨૦૨૪

PUBLIC NOTICE

The Death Claim in Respect of Patel Rameshbhai Naranbha was lodged on the Royal Sundaram General Insurance Company Limited and in the Absence of an Assignment the claim in Being settled in favour of Smt. Patel Labhuben Rameshbhai Claimant. In case there is any other claimant of the claim she should lodge a claim to that effect within one month in the event failing to do so the claim will be settled in favour of Patel Labhuben Rameshbhai

Royal Sundaram General Insurance Company Limited No. 46. Whites Road, Chennai- 600014

BHAGWATI AUTOCAST LIMITED

(CIN: L27100GJ1981PLC004718) Regd. Office: Survey No. 816, (New Survey No. 259), Village: Rajoda, Nr. Bavla, Dist. Ahmedabad - 382 220. Ph. +91 2714-232283 / 232983 / 232066, E-mail: cs@bhagwati.com STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30.06.2024

Quarter Ended Year Ended 31.03.2024 (Audited) 30.06.2024 31.03.2024 30.06.2023 13,449.49 Total Income from operations 396.92 407.36 Net Profit for the period before tax 963.96 Net Profit for the period after tax 204.54 693.02 profit for the period (after tax) and other compreh 419.06 ncome (after tax)] 703.53 Equity share capital (Face value per share Rs. 10/- each) Reserves excluding revaluation reserves 3.800.12 Earnings per share (before and after extraordinary items (of Rs. 10/- each) Basic & Diluted

Directors of the Company in their respective meetings held on August 07, 2024. The statutory Auditors of the company have carried out review of aforesaid results as per Regulation 33 of the SEBI (Listing Obligation and

Disclosure Requirements) Regulation, 2015.

[2] The financial results for the quarter ended june 30, 2024 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and

other recognised accounting practices and policies to the extent applicable.

[3] The above is an extract of the detailed format of Financial Results for the Quarter ended 30th June, 2024, filed with the Stock Exchanges, under the Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the Stock Exchange website www.bseindia.com and on the Company's website www.bsagwati.com

By Order of the Board of Directors For, Bhagwati Autocast Limited

(Dr. P. N. Bhagwati) DIN: 00096799

ડીજીજીઆઇએ ૧૦ વિદેશી એરલાઇન્સોને ૧૦,૦૦૦ કરોડની જીએસટીની નોટીસ ફટકારી

સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સ નોટીસ મોકલવામાં આવી હતી. ડીજીજીઆઇ એ દેશમાં કાર્યરત ૧૦ મોકલી હતી .

સત્તાવાર જણાવવામાં આવ્યું હતું

બાઈક પર જતાં એક જ પરિવારના પાંચને અજાણ્યા વાહને કંગોળ્યા

અકસ્માતના બનાવો બની રહ્યા આવી હતી. બાઇક પર સવાર છે. તેમાં પણ હાઈવે પર તમામલોકો એક જ પરિવારના અકસ્માતની ઘટનામાં સતત હોવાનું કહેવાય છે. પોલીસે વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ હાલ અકસ્માતની વધુ તપાસ એક ભયાનક અકસ્માતની હાથ ધરી છે અને કન્ટેનર

^{६ ट्रन ।} परिवारना पने ચિત્તાો ડગઢ-નિમ્બહેરા **વાહને ફંગોળતાં** રા ષ્ટ્રી ય **કમકમાટીભર્યા મોત** છે. બાઇક પર ધોરીમાર્ગ પર **કમકમાટીભર્યા મોત** એક દંપતી, બે

મંગળાવારે (૦૬ ઓગસ્ટ) રાત્રે મૃતદેહોને પીએમ અર્થો થતાં જ ચિત્તોડગઢ સદર પોલીસ હતા. મૃતકોની ઓળખ સ્ટેશનના અધિકારી ટીમ સાથે શંભુપુરાના રહેવાસી તરીકે થઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે.

જયપુર, તા.૭ ગયા હતા. ઘટનાસ્થળે દેશમાં છેલ્લા ઘણા સમયમાં એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં ખ્રિ**ટિશ એરવેઝ , લકુયાન્સા ,**

બની છે. જેમાં એક કન્ટેનરે યુવકો, એક છોકરી અને એક બાઈક સવાર પરિવારને કચડી વર્ષનો માસૂમ બાળક સવાર કરવામાં આવે છે, અને તેથી તે કર નાખ્યો હતો. આ અકસ્માતમાં હતા. આ તમામ લોકો નિંબાહેડા પાત્ર છે. ઓગસ્ટ ૨૦૨૩ માં આ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત તરફ જઈ રહ્યા હતા ત્યારે ^{બાબતની} તપાસ શરૂ કરવામાં આવી થયા હતા, જ્યારે એક માસુબ બાવળીયા પોલીસ વિસ્તારમાં આ બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. કરૂણ અકસ્માત સર્જાયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે મુજબ અકસ્માતની ઘટના હોસ્પિટલમાં દાખલ કરવામાં ભવલિયા ગામ નજીક આવી હતી. તેમજ તમામ સેવાઓની સચિની માંગ કરી હતી.

શોધખોળ માટે

નાકાબંધી કરી

નવી દિલ્હી.તા.૬ એરવેઝ , લુફ્થાન્સા , ઓમાન એર , મુક્તિ અને બિન-મુર્ક્તિ બંને સેવાઓમાં ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગુડ્ઝ એન્ડ અમીરાત અને સિંગાપોર એરલાઈન્સને સોદો કરે છે અને તે તેમને પરિપત્ર હેઠળ અયોગ્ય બનાવે છે.

વિભાગના ઘણા કર્મચારીઓનો

કાઢી મૂકવામાં આવ્યા છે. આ

ઉપરાંત તેમના ઘણા જાણકારો

એક અધિકારીએ જણાવ્યું હતું કે વિદેશી એરલાઇન્સને ૧૦,૦૦૦ કરોડના 🗦 તાજેતરની સંકલિત જીએસટી માંગને 🛮 ડીજીજીઆઇ એ અગાઉ એરલાઇન્સ ટેક્સની ચુકવણી ન કરવા બદલ નોટિસ પગલે ઇન્ફોસિસ દ્વારા ટાંકવામાં આવેલા પાસેથી મકિત અને બિન-મુકિત પરિપત્રમાં કરપાત્ર અને કર મુકત સેવાઓની અલગ યાદી માંગી હતી. ૧૦ છે દ્વા ત્રણ દિવસમાં બ્રિટિશ જીએસટી હોય છે તે મુજબ એરલાઈન્સ માંથી માત્ર ચાર એરલાઈન્સે સુચિ પ્રદાન કરી હતી અને બાકીની કોઈપણ એરલાઇન્સે ખુલાસો રજૂ કર્યો ન હતો. નોટિસ જુલાઈ ૨૦૧૭ થી માર્ચ ૨૦૨૪ સુધી જીએસટી પર લાગુ કરવામાં આવી હતી.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ એરલાઇન્સનું ઓવરસીઝ હેડકવાર્ટર

ઓમાન એર , અમીરાત અને સિંગાપોર એરલાઇન્સએ જીએસટી ન ચુકવવા બદલ નોટીસ આપી

એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ તેમજ ક્રૂ અને ભાડા જેવી સેવાઓ પૂરી પાડે છે. ડીજીજીઆઇ કહે છે કે આ સેવાઓ એક કાનૂની એન્ટિટીથી બીજીને ઓફર હતી. ડીજીજીઆઇ એ ગયા વર્ષે ડિસેમ્બરમાં અને આ વર્ષે જાન્યુઆરીમાં આ એરલાઇન્સના ભારતીય કાર્યાલયોના મુખ્ય અધિકારીઓને સમન્સ પાઠવી અને સ્પષ્ટીકરણો અને કરમ્કત

વિદેશી એરલાઈન્સે દલીલ કરી હતી બની હતી. આ ઘટનાની જાણ 🛮 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા 🦠 સેવાનું સ્થળ હેડ ઓફિસ અને બ્રાન્ચ ઓફિસ બંને હોવાથી એરલાઈન્સ ભારતમાં જે કરપાત્ર છે તેના પર જ જીએસટી ચૂકવી શકે છે.

HARSHA ENGINEERS INTERNATIONAL LIMITED

CIN:L29307GJ2010PLC063233

Regd. Office: Sarkhej-Bavla Road, Changodar, Ahmedabad, Sanand-382213, Gujarat, India.

Ph: +91 2717 618200, Fax: +91 2717 618259 Web: www.harshaengineers.com Email: sec@harshaengineers.com STATEMENT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2024 (₹ in Lakhs)

Ш				Consolidated				
Ш.				Quarter Ended				
	Sr. No.	Particulars	30-06-2024	31-03-2024	30-06-2023	31-03-2024		
		Ū		Audited	Unudited	Audited		
				Refer Note 4				
	1	Total Income from Operations	34,316	38,040	34,796	139,230		
Ш	2	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	5,030	4,948	3,364	15,075		
Ш	3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional Items)	5,030	4,948	3,364	15,075		
Ш	4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	3,605	3,678	2,458	11,143		
Ш	5	Total Comprehensive Income for the period [comprising profit / (Loss)	3,645	3,826	2,805	11,543		
Ш		for the period (after tax) and other Comprehensive Income (after tax)]						
Ш	6	Equity Share Capital (Paid-up)	9,104	9,104	9,104	9,104		
Ш	7	Other Equity (Excluding Revaluation Reserve) as per the Audited Balance Sheet of previous year	-	-	-	108,424		
	8	Earnings Per Share (of ₹ 10 each) (not annualised) (for discontinued and continued operations)						
		(a) Basic	3.96	4.04	2.70	12.24		
		(b) Diluted	3.96	4.04	2.70	12.24		

Notes:

l	1. /	Additional Information of Unaudited Standalone Financial Results is as under:					
ı				Standalone			
ı				Quarter Ended			
	Sr. No.	Particulars	30-06-2024	31-03-2024	30-06-2023	31-03-2024	
ı			Unaudited	Audited	Unudited	Audited	
ı				Refer Note 4			
ı	1	Revenue from Operations	25,830	29,753	25,616	108,094	
ı	2	Profit / (Loss) before Tax	5,175	5,008	3,889	16,765	
ı	3	Profit / (Loss) After Tax	3,856	3,759	2,976	12,691	
١	4	Total Comprehensive Income (after tax)	3,896	3,907	3,323	13,091	

2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites viz. www.bseindia.com and www.nseindia.com. The same are also available on the Company's website viz. www.harshaengineers.com.

3. The above Unaudited Financial Results for the quarter ended 30 June, 2024 have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors in their respective meetings held on 7 August, 2024.

4. Figures of the quarter ended 31 March, 2024 is the balancing figures between audited figures in respect of the full financial year and year to date figures up to the third quarter of the relevant financial year. Also the figures up to the end of third quarter had only been reviewed and not subject to audit.

> By order of Board of Directors For, HARSHA ENGINEERS INTERNATIONAL LIMITED

> > Sd/-

Raiendra Shah Chairman & Whole Time Director DIN: 00061922

Place: Ahmedabad Date: 7 August, 2024



































